

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટન ઉજવશે ઓનલાઇન કેનેડા ડે JUNO પુરસ્કર્તા મુખ્ય રજૂઆતકર્તા Walk Off The Earth સાથે.

બ્રમ્પટન, ઓન્ટારિયો (23 જૂન 2020) – COVID-19 ફેલાતો રોકવા માટે બ્રમ્પટન તેમની કેનેડા ડે ની ઉજવણી ઓનલાઇન કરવા જઈ રહ્યા છે! JUNO પુરસ્કાર વિજેતા બેન્ડ Walk Off The Earth નું નામ મુખ્ય રજૂઆતકર્તા તરીકે જાહેર કરતા સિટીને રોમાંચની લાગણી થાય છે.

મધ્યાહનથી રાત્રે 10 વાગ્યા સુધી જુલાઈ 1 ના રોજ બુધવારે ઈવેન્ટ www.brampton.ca/canadaday પર હાથ ધરાશે. પારિવારિક મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓ થશે, અસ્સલ કેનેડિયન રેસિપીઓ, ટેક આઉટ અને ડિલિવરી વિકલ્પો ધરાવતી રેસ્ટોરન્ટોની યાદી હશે અને આખા દિવસ દરમિયાન બીજું ઘણું બધું ઓનલાઇન ઉપલબ્ધ રહેશે.

આ વર્ષે, બધાને મળશે બ્રમ્પટનના કેનેડા ડેના મંચ સામે પ્રથમ હરોળની બેઠકો અને તે પણ પોતાના ઘરેથી. Alectra દ્વારા રજૂ થનાર ડિજિટલ મંચ તેમનું સ્ટ્રીમિંગ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે જેમાં સ્થાનિક કલાકારો પોતાની પ્રસ્તુતિ કરશે અને JUNO પુરસ્કાર વિજેતા મુખ્ય પ્રસ્તુતકર્તા Walk Off The Earth તો ખરા જ.

સાંજે 8 વાગ્યે, સ્ટ્રીમ કરેલ કાર્યક્રમ CBC ના રાષ્ટ્રીય કેનેડા ડેના ઓટાવાથી થનાર પ્રસારણમાં રૂપાંતરિત થશે, જ્યાં રજૂ થનાર અનેક કેનેડિયન કલાકારો પૈકી બ્રમ્પટનનાં કલાકાર હાવિઆ માઈટી (Haviah Mighty) પણ છે.

ઉજવણીના સમાપનમાં દર્શકો લઈ શકશે રોમાંચક આતશબાજીનો અનુભવ તે પણ ઓગમેન્ટેડ રિએલિટીમાં. ટિમ હોર્ટન્સ દ્વારા પ્રાયોજીત ડિજિટલ આતશબાજીનું પ્રદર્શન નાગરિકોને પરંપરાગત કેનેડા ડેની આતશબાજીની અવેજમાં એક અનન્ય અને સુરક્ષિત વિકલ્પ COVID-19ના રોગચાળા દરમિયાન પૂરું પાડશે. Snapd Community Hub દ્વારા જેને પાવર કરવામાં આવેલ છે તે વર્ચુઅલ શો રાત્રે 10 વાગ્યે ઓનલાઇન શરૂ થશે.

બ્રમ્પટન કેનેડા ડે અલેક્ટ્રા (Alectra), ટીમ હોર્ટન્સ (Tim Hortons), ઓલસ્ટેટ (Allstate), અલગોમા યુનિવર્સિટી (Algoma University) અને બેલ (Bell) દ્વારા પ્રાયોજીત છે.

સોશયલ બનો!

- સોશયલ મિડિયા પર અમને @ExperienceBrampton અને @CityBrampton પર ફોલો કરો.
- તમારા ઘરે આપે કરેલ કેનેડા ડેની ઉજવણીના ફોટા #BramptonCanadaDayatHome અને #BramptonTogether ના હેશટેગ વાપરીને શેર કરશોજી.
- સ્થાનિક રેસ્ટોરન્ટનું ભોજન માણો છો? વાપરો #SupportLocalBrampton.

અવતરણો

"બ્રેમ્પટન કેનેડા ડે ની ઉજવણી આ વર્ષે થોડી અલગ જણાશે જેથી બધાને આપણે COVID-19 થી સ્વસ્થ અને સલામત રાખી શકીએ. જુલાઈ 1 ના રોજ હું બધાને અરજ કરું કે www.brampton.ca/canadaday ની મુલાકાત લઈને પારિવારિક મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓમાં ભાગ લો, કેનેડિયન ભોજન બનાવો અને સ્થાનિક રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપી ભોજન મંગાવો અને આપણા દેશને વધાવી લેતા બ્રેમ્પટનના કલાકારોની પ્રસ્તુતિઓ તેમજ JUNO પુરસ્કાર વિજેતા હેડલાઈનર Walk Off The Earth ને માણો – હું અને મારો પરિવાર તો આખો દિવસ આ ઉજવણીઓ માણવાના છીએ!"

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટનનો કેનેડા ડે આ વર્ષે થોડો અંતરંગ રહેશે પણ તે જાહેર હિતમાં છે. ગમ્મત કરો અને સુરક્ષિત રહો – તમે સ્થાનિક વ્યવસાયને મદદરૂપ થઈને બ્રેમ્પટનમાં રહેલ અનેક સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટોમાંથી ટેકઆઉટ ઓર્ડર કરી શકો, અમે લાઈન અપ કરેલ વિવિધ પ્રસ્તુતિઓના તાલે ડાન્સ પાર્ટી કરી શકો, એક અજોડ ઓનલાઈન આતશબાજીનો લુક્ટ ઉઠાવી શકો અને બીજું ઘણું બધું છે જે કરી શકશો!"

- ગૂરપ્રીત ધિલ્લોન, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 9 & 10, સીટી ઓફ બ્રેમ્પટન; ઉપ-પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર

"અમે કેનેડા ડેને આ વર્ષે COVID-19 નો સામનો કરવા બધાં લોકોનું આરોગ્ય અને સલામતી જાળવવા માટે ઓનલાઈન કરી રહ્યા છીએ. આપણે ભૌતિક રીતે એક બીજાથી દૂર હોવા છતાં એકબીજા સાથે જોડાયલા રહી શકીશું! તમે ઘરે ઉજવેલ કેનેડા ડેના ફોટા અને વિડિયોને સોશયલ મિડિયા પર #BramptonCanadaDayatHome, #BramptonTogether વાપરીને ચોક્કસપણે શેર કરશોજી અને જો કોઈ સ્થાનિક રેસ્ટોરન્ટનું ભોજન માણો તો #SupportLocalBrampton વાપરશો.

- પૉલ વિસેન્ટ, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 1 & 5, સીટી ઓફ બ્રેમ્પટન; ઉપ-પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર

"શહેરને ફરી ચાલુ કરવાના કાર્યને આગળ ધપાવવા સાથે કમ્યુનિટી સ્વાસ્થ્ય અને સલામતી અમારે માટે ટોચની અગ્રીમતા ધરાવે છે. કેનેડા ડે બ્રેમ્પટનની સૌથી મોટો ઉત્સવ રહ્યો છે અને હું બધાંને અરજ કરું કે ઘરે રહેશો અને આ વર્ષે સુરક્ષિત રીતે ઉજવણી કરશો. અમે આપને COVID-19 સામેના આગામી પગલાં વિષયક સમાચાર આપતા રહીશું."

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રિજનલ કાઉન્સિલર, વોર્ડ 3 & 4 પ્રમુખ, રિઓપનિંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સિટી ઓફ બ્રેમ્પટન

"જેમ જેમ સિટી ઓફ બ્રેમ્પટન પુનઃ શરૂ થઈને સાજા થવાની સફર પર છે ત્યારે અમારા કર્મચારીઓએ કેનેડા ડે તમામ લોકો ઉજવી શકે અને માણી શકે તે માટે જોરદાર પ્રવૃત્તિઓ અને પ્રસ્તુતિઓની લાઈન અપ ઓનલાઈન ઊભી કરી છે. સુરક્ષિત રહેશો અને આ વર્ષે કેનેડા ડેના ઉત્સવને પોતાના ઘરમાં જ ઉજવશો."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca